

### ૩ (૧૮) કાથી રેશા અન્ય રેશા તથા સુતર-પ્લાસ્ટીક માંથી વસ્તુઓ બનાવવી

#### ૧. પ્રસ્તાવના

##### અ. ઉપયોગીતા :-

હાલ ગુજરાત ભરમાં કાથીમાંથી બે પડની દોરી, દોરડાં વિ. વણાટનો ઉદ્યોગ પ્રચલિત છે. સાથે કેનકી શાશું, સુતર કે મોનો ફીલામેન્ટયાર્નમાંથી બે પડની દોરી, દોરડાં વણવાનું પ્રચલિત છે. ખાટલા ભરવા, કુવામાંથી પાણી કાઠવા, ઢોર બાંધવા, મચ્છીમારી વિ. માટે દોરી, દોરડાનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાપ છે.

આ સાથે કાથીની દોરી, કાથીના રેસા તથા ઈનર જાતના રેશામાંથી પગલુધણીયા, જોતર વિ. જીનાવી શકાય છે. હાલમાં જીવનની જરૂરિયાન સ્વચ્છતા જાળવવી એ પણ છે. જે માટે પણ પગલુધણીયા મધ્યમ અને ઉચ્ચ વર્ગના ધરોળા પ્રમાણમાં વપરાય છે.

##### બ. બજાર અને બજાર વ્યવસ્થા :-

દોરી, દોરડા, જોતર વિ. બહોળા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતી કામમાં વપરાય છે. જેથી આ આઈટેમોના વેચાણ માટે ગ્રામ્ય કક્ષાએ સેવા સહકારી મંડળીઓ, સંઘો સાથે સંપર્ક કરી બજાર વ્યવસ્થા ગોઠવી શકાય.

પગલુધણીયા, થેલી વિ. માટે નાલુકા તથા જિલ્લા કક્ષાએ ખાદી ગ્રામોદ્યોગ બંડાર, તથા હોલસેલ વેપારીઓ સાથે સંપર્ક કરી વેચાણ વ્યવસ્થા ગોઠવી શકાય.

##### ક. ધારણાઓ :-

- (૧) આ ઉદ્યોગ માટે મકાનની કોઈ ખાસ આવશ્યકતા રહેતી નથી. દેસ્ક, દોરડાનું વણાટકામ માટે પડતર પ્લોટમાં કે ખુલ્લા મેદાનમાં કરી શકાય. જે માટે સાધારણ રીતે ધરની જ વ્યક્તિઓ હોય છે.
- (૨) લોન લેનાર વ્યક્તિએ આ આઈટેમોના ઉત્પાદન માટે જરૂરી તાલીમ એકાદ અઠવાડિયાની

મેળવવાની રહે. જેની તાલીમ કુટીર ઉદ્યોગ હસ્તક ચાલતા કાથી કેન્દ્રો મહુવાદ સંજાણ, અંભાજમાં છે. સરકારશ્રી જે તે સ્થળે કોઈપણ સંસ્થાના સભ્યો માટે આનું નિર્દર્ઘન ગોઠવી તાલીમ આપી શકે છે.

### ૨. ઉત્પાદન પ્રક્રિયા :-

- (૧) દોરી, દોરડાં જે કાચામાલમાંથી દોરી, દોરડાં બનાવવાના હોય તેને એટલે કે સુતર, મોનોફીલામેન્ટયાર્ન વિ.ને જાડાઈ પ્રમાણે વણાટ મશીન ઉપર વળ ચઢાવી વણવામાં આવે છે.
- (૨) બેલીઓ, પગલુધણીયા, જોતરા કાથી કેશા કે સુતર (કે પ્લાસ્ટિક) રંગાપેલ હોય તેમાંથી જુદી જુદી રીજાર્ડનો પાડીને ગુંધવામાં આવે છે.

### ૩. ઉત્પાદનક્ષમતા :-

ઉત્પાદિત આઈટેમ ઉપર અને કાચામાલના વપરાશ ઉપર ઉત્પાદન ક્ષમતાનો આધાર રહે. અંદાજ માસિક રૂ. ૮,૫૦૦/-નું ઉત્પાદન ગણેલ છે.

### ૪. પરવાના અંગેની ખાસ જરૂરિયાત :-

પરવાના અંગે કોઈ ખાસ જરૂરિયાત રહેતી નથી.

### ૫. સ્થાપી મૂડી રોકાણ :-

#### અ. જમીન/મકાન

ખુલ્લો ખોટ અંદાજ ૫૦" x ૧૫" = ૭૫૦ ચોટ જોઈજે. જેનું માસિક ભાડું રૂ. ૩૦૦/- ગણેલ છે.

#### બ. પ્લાન્ટ/મશીનરી/સાધનો/ફન્ચિર વિ.

| અ.નં. | સાધનોનું વર્ણન  | સંખ્યા | કિમત (રૂ.)  |
|-------|---|--------|-------------|
| ૧     | ૨   | ૩      | ૪           |
| (૧)   | દોરડા વણાટ મશીન ૬ હુકનું ક્રમપલીટ પાવર<br>ઓપરેટર ટ્રોલી સાથે ૨ હોપા. મોટર સાથે    | ૧      | રૂ. ૪,૦૦૦/- |
| (૨)   | સીંગલ પ્લાય ચરખા (સ્ટેન્ડ સાથે)   | ૧૨     | રૂ. ૩,૦૦૦/- |
| (૩)   | પગલુધણીયા બનાવવા માટે ફેમો ૨' x ૧ ૧/૪'<br>તથા ૩ x ૧ ૧/૨' લોખંડના અંગલની બોલ્ટવાળા | ૫૦     | રૂ. ૨,૦૦૦/- |
| (૪)   | ગડીયા, કાતર, પંજ, લોખંડની પટ્ટી રૂચાની<br>સળીયા ઉંલબાઈના વિ.                      |        | રૂ. ૧,૦૦૦/- |

(૫) રેશમીડર નથીન બીન, ૩ હોપાલ ઈલે. મોટર સાથે ૩. ૧૦,૦૦૦/-

કુલ ૩. ૨૯,૦૦૦/-

ક. ઓફિસ ફિનાચર વિ. :-

નીલ - ૩. -

૬. કુલ સ્થાપી મૂડી રોકાણ : - ૩. ૨૯,૦૦૦/-

૭. ચાલુ મૂડી (કાર્પકારી ભંડોળ) :-

કાર્યોમાલ જેવો કે સુતર, કાથી વિ. તથા મોનોફિલામેન્ટયાર્ન ૨ માસનો તથા ૧ માસનો પગાર  
અને પાવર ખર્ચ મળીને કુલ ૩. ૧૨,૦૦૦/-

૮. કુલ મૂડી રોકાણ : - ૩. ૩૩,૦૦૦/-

૯. બેંક લોન (ટર્મલોન તથા કાર્પકારી ભંડોળ) :-

બેંક લોન ૬ (૭) માસના મોરેટોરીયમ પીરીપડ બાદ ૬૦ માસિક હમાથી ભરપાઈ કરવાની રહે.  
વ્યાજનો દર ૧૪ ટકા ગણેલ છે. ૩. ૩૩,૦૦૦/-

૧૦. આવર્તક ખર્ચ (ઉત્પાદન ખર્ચ) માસિક :-

અ. કાર્યોમાલ

(૧) કાથી ૧૨૫ કિલો. X ૩. ૧૦ = ૧,૨૫૦/-

(૨) કેળ/કેતકિના થાંભલા ૮૦૦ X ૩. ૨/- = ૩. ૧૬૦૦/-

(૩) મોનોફિલામેન્ટ યાર્ન ૫૦ કિલો X ૩. ૩૦/- = ૫૦૦/- ૩. ૪,૩૪૦/-

બ. પગાર ખર્ચ

૩ વ્યક્તિ X ૩. ૨૨/- દૈનિક X ૨૫ દિવસ ૩. ૧,૬૫૦/-

ક. પાવર ખર્ચ ૩. ૧,૦૦૦/-

૫. બેંકનો હમો વ્યાજ સાથે ૩. ૮૨૫/-

૬. પેકીંગ ખર્ચ ૩. ૧૦૦/-

૭. ઘસારા ખર્ચ ૩. ૧૭૫/-

૮. રીપેર, સ્ટોર્સ, અન્ય વપરશી વસ્તુ વિ. ૩. ૧૦૦/-

૯. મકાન ભાડું ૩. ૩૦૦/-

૧૦. અન્ય ખર્ચ ૩. ૨૦૦/-

કુલ આવર્તક ખર્ચ ૩. ૮,૯૦૦/-

૧૧. કુલ વેચાણ (માસિક) :-

કાથી મોનોફિલામેન્ટ, સુતરના દોરડાં વિ. વેચાણ અન્ય રેશાના ઉત્પાદનો જેવાકે થેલી,  
પગલુધ્યાળીપા વિ. ૩. ૮,૫૦૦/-

## ૧૨. નિર્ણાતોટનો અંદાજ (માસિક) :-

|                         |             |
|-------------------------|-------------|
| કુલ વેચાણ માસિક         | રૂ. ૬,૫૦૦/- |
| બાદ : માસિક આવર્તક ખર્ચ | રૂ. ૪,૯૦૦/- |
| ચોખ્ખો નષ્ટો માસિક      | રૂ. ૮૦૦/-   |

## ૧૩. અન્ય વિગતો :-

ઉત્પાદન કાર્યમાં લોન લેનારના કુટુંબીજનો પણ મજૂરીકામ કરતાં હોવથી માસિક વધારાની પુરક રોજગારી મળી શકે.

## ૧૪. ખાસ નોંધ :-

ઉદ્યોગને અનુરૂપ આનુષ્ઠાંગિક મશીનરી/સાધનોની ભલામણ ઉદ્યોગની રકમની મર્યાદામાં ટી ઓ/આઈ.પી.ઓનો અભિપ્રાય મેળવી કરવાની રહેશે.

## ૧૫. કાચાના માલના ઉત્પાદકો/વિતરકો :-

- (૧) મે. નેપરચુન ટ્રેડીંગ કુ., ન્યુ ક્લોથ માર્કેટ રાયપુર, અમદાવાદ.
- (૨) મે. પી. જ્યાંતિલાલ. ન્યુ ક્લોથ માર્કેટ રાયપુર, અમદાવાદ.

## ૧૬. મશીનરી/સાધનો/ડાઇઝટુલ્સના ઉત્પાદકો/વિતરકો :-

- (૧) મે. શ્રીચંદ એન્છ. વર્ક્સ, સૈજપુર બોધા, નરોડા અમદાવાદ.
- (૨) મે. કિના એન્છ. સૈજપુર બોધા, નરોડા અમદાવાદ.
- (૩) દોરડા વણાટ, ચરખા સ્થાનિક લુહાર પાસેથી બનાવવાના રહે.
- (૪) મે. બુપેન્દ્ર એન્ડ બ્રધર્સ. સ્વામીનારાયણ ગોડાઉન, દરવાજા બહાર, અમદાવાદ.